



મણીનગર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી,ની કચેરી  
મણીનગર પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર



ટેલીફોન નંબર -૦૭૯૨૫૪૬૦૦૮૯

Email.[polstn-mani-ahd@gujarat.gov.in](mailto:polstn-mani-ahd@gujarat.gov.in)

તારીખ:૧૮/૦૭/૧૯

## પ્રેસનોટ

**ઘરફોડ ચોરીની આંતર રાજ્ય ગેંગ (દિલ્લી)ને પકડી પાડી મણીનગર  
પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૯/૨૦૧૯ ધી.ઇ.પી.કો.કલમ ૪૫૪,૩૮૦ મુજબનો ગુનો શોધી  
કાઢતી મણીનગર પોલીસ**

મે.પોલીસ કમિશ્નર શ્રી તથા અધિક પોલીસ કમિશ્નર શ્રી સેક્ટર-૨ સા. તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૬ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ' જે ' ડીવીજન નાઓની સુચનાને આધારે તેઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુન્હા શોધી કાઢવા સારૂ જુદી-જુદી પો.ઇન્સ.એસ.એમ.પટેલ તથા સર્વે સ્કોડનાં પો.સબ.ઇન્સ.જે.કે.બાવીસ્કર તથા પો.સબ.ઇન્સ.ટી.એન.મોરડીયા તેમજ બીજા સ્ટાફ નાં માણસો પો.કો.મોહસીનહુસેન મહેદીહુસેન બંનં.૯૯૩૨ તથા પો.કો.અર્જુનસિંહ ભાવસિંહ બં.નં.૯૯૯૬ તથા પો.કો.પ્રવીણભાઇ ભાઇલાલભાઇ બં.નં.૪૭૮૩ તથા પો.કો.રામજીભાઇ જાગાભાઇ બં.નં.૯૯૦૯ તથા અ.લો.ર.જામાભાઇ માત્રાભાઇ બં.નં.૧૩૦૬ નાઓ સાથે બાતમી આધારે મણીનગર રેલ્વે સ્ટેશન પાસે વાહન ચેકીંગ ની કામગીરી કરતા હતા તે દરમ્યાન ક્લાક ૧૪/૦૦ વાગે મણીનગર રેલ્વે સ્ટેશન તરફ થી ચાર ઇસમો શકમંદ રીતે ચાલતા આવતા તેઓ ને રોકી ઉભા રાખી પુછપરછ કરતા તેઓ રાજ્ય બહાર નાં વતની હોય અને શકમંદ લાગતા જે ઇસમો (૧) ભરત ઉર્ફે ગોલુ અશોક ચૌધરી ઉ.વ.૨૨ રહે બી/૨/૧૬૯ પ્લોટ નં.૨૭ હર્ષવિહાર નંદનગરી ઉત્તર પુર્વ દિલ્લી પી.નં.૧૧૦૦૯૩ (૨) રીઝવાન ઉર્ફે દઉવા સન/ઓફ ઇસરાહશન અપ્પુખાન જાતે પઠાણ ઉ.વ.૨૮ ધંધો સિલાઇ કામ હાલ રહે:ગલી નં.૧૩ બડી મસ્જીદની બાજુમાં પાણીની ટાંકી પાસે મંડોલી દિલ્હી મુળ વતન ગામ સેહઝાનપુર યુ.પી. (૩) જાહેદખાન સંગાખાન પઠાણ ઉ.વ.૩૨ ધંધો:કબાડી કામ રહે:મંડોલી મ.નં.બી/૧૮ બેંક કોલોની સ્ટેન્ડ રાજીવનગર ગલી નં.૧ દિલ્હી (૪) શાહનવાઝ સન/ઓફ સાજીદ શકરુઉલ્લા જાતે સિદ્દીકી ઉ.વ.૩૩ ધંધો સિલાઇ કામ રહે:બ્લોક નં. એચ/૨૧૮ જે.જે.કેમ્પ પીન કોર્ડ નં.૧૧૦૬૨ તેઓની પાસે થી રોકડા રૂપીયા ૫૬૭૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ.૧૦૮૦૦/- અને ઘરફોડ ચોરીના સાધનો પક્કડ, ડીસમીસ, લોખંડના ખાતરીયા

સાથે મળી આવી મણીનગર પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલી અને આ કામના ઉપરોક્ત ચારેય આરોપી ઇસમો જેઓ આંતર રાજ્ય ના હોય અને તેઓ એકબીજા પ્લેન તથા ટ્રેન મારફતે આવી ઘરફોડ ચોરીને અંજામ આપતા હોય અને આ આંતર રાજ્ય ઘરફોડ ચોરીની ગંગે બીજી પણ ઘરફોડ ચોરીઓ ને અંજામ આપેલ છે કે કેમ ? તે દિશામા તપાસ ચાલુ છે અને મણીનગર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૯/૨૦૧૯ ધી.ઇ.પી.કો.કલમ ૪૫૪, ૩૮૦ મુજબના કામે રોકડ રૂ.૨૫૦૦૦૦/- તથા સોનાના દાગીના રૂ.૫૮૦૦૦૦/- તથા ચાંદીના દાગીના રૂ.૪૫૦૦૦૦/-મળી કુલ રૂ.૩૫૩૦૦૦૦/-ની ચોરીનો ભેદ ઉકેલી કાઢેલ છે આગળ મુદ્દામાલ રીકવર કરવાની કાર્યવાહિ ચાલુ છે.તા.૧૮/૦૭/૨૦૧૯

